

8th January, 2026

To,
Department of Corporate Services
BSE Limited
P. J. Towers, Dalal Street,
Fort, Mumbai - 400 001

Security Code: 542 460
Security ID: ANUP

To,
Listing Department
National Stock Exchange of India Limited
Exchange Plaza, 5th Floor Plot No. C/1,
G. Block Bandra-Kurla Complex, Bandra (E),
Mumbai - 400 051

Symbol: ANUP

Dear Sir/Madam,

Subject: Submission of newspaper advertisement in respect of Postal Ballot Notice and Remote e-Voting

Pursuant to Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we enclose herewith the copies of the newspaper advertisement published on 8th January, 2026 in the Financial Express (In English - All India edition and in Gujarati - Ahmedabad Edition) in respect of Postal Ballot Notice and Remote e-Voting information.

You are requested to take note of the same.


Thanking you,

Yours faithfully,
For, The Anup Engineering Limited

Lay Desai
Company Secretary
Membership No.: A57117



Encl.: As above



THE ANUP ENGINEERING LIMITED
CIN: L29306GJ2017PLC099085
Regd. Off: Behind 66 KV Elec. Sub-Station, Odhav Road, Ahmedabad-382415
Tel.: +91 079- 4025 8900, Email: investorconnect@anupengg.com Website: www.anupengg.com

NOTICE OF POSTAL BALLOT

Notice is hereby given, pursuant to the provisions of Section 110 of the Companies Act, 2013 (**"the Act"**) read with Rules 20 and 22 of the Companies (Management and Administration) Rules, 2014 (**"the Rules"**), the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (**"SEBI LODR Regulations"**), General Circular Nos. 14/2020 dated 8th April, 2020, 17/2020 dated 13th April, 2020, and subsequent circulars issued in this regard, the latest being 03/2025 dated 22nd September, 2025, issued by Ministry of Corporate Affairs (**"MCA Circulars"**) that the Company is seeking approval of members for the special businesses as set out in the Postal Ballot Notice dated 10th November, 2025 (**"Postal Ballot Notice"**). Members are informed that the Postal Ballot Notice along with relevant Explanatory Statement and e-voting instructions for remote e-voting have been sent to members who have registered their email addresses with the Company or Depository Participant(s) on their registered e-mail addresses as on the cut-off date.

The Postal Ballot Notice has been sent to email addresses of those members whose names appeared in the Register of Members / List of Beneficial Owners as received from the National Securities Depository Limited (**"NSDL"**) and Central Depository Services (India) Limited (**"CDSL"**) as on Friday, 2nd January, 2026 (**"the Cut - Off Date"**). The voting rights shall be reckoned on the paid-up value of the shares registered in the name of members as on the Cut - Off Date. A person who is not a member as on the Cut - Off Date should treat this notice for information purpose only.

Members should note that in terms of the MCA Circulars, no physical ballot form is being dispatched by the Company and the Members can cast their vote using remote e-voting facility only.

Pursuant to the MCA Circulars, Members whose email addresses were not registered with the Company or Depository Participant(s) as on the Cut - Off Date, are requested to register their email addresses by sending an email citing subject line as "Anup-Postal Ballot-Registration of e-mail Ids" to our RTA i.e. MUGF Intime India Private Limited at ahmedabad@in.mpmms.mugf.com or to the Company at investorconnect@anupengg.com with name of registered shareholder(s), folio number(s) / DP Id(s) / Client Id(s) and No. of shares held from the email address they wish to register to enable them to exercise their vote(s) on the special businesses as set out in the Postal Ballot Notice through remote e-voting facility provided by NSDL. For details of the manner of casting voting through remote e-voting by the members holding shares in physical form or who have not registered their email addresses with the Company or Depository Participant(s), members are requested to refer instruction no. 9 of the Postal Ballot Notice.

In accordance with the provisions of Section 108 of the Act read with the Rules, the MCA Circulars and Regulation 44 of the SEBI LODR Regulations, the Company is providing facility to its members to exercise their votes electronically in respect of item enlisted in the Postal Ballot Notice through the remote e-voting facility provided by NSDL.


Details of Postal Ballot Schedule:

Sr. No.	Particulars	Schedule
1	Date of Completion of dispatch of postal ballot notice	Wednesday, 7 th January, 2026
2	Cut - off date for identification of voting rights of the members	Friday, 2 nd January, 2026
3	Date and time of commencement of remote e-voting	Thursday, 8 th January, 2026 [09:00 a.m.]
4	Date and time of end of remote e-voting	Friday, 6 th February, 2026 [05:00 p.m.]
5	Remote e-voting shall not be allowed beyond	Friday, 6 th February, 2026 [05:00 p.m.]
6	Scrutinizer	Ms. Ankita Patel, Designated Partner of ALAP & Co. LLP, Practicing Company Secretary (CP No. 16497)
7	Contact details of the person at NSDL responsible to address the grievances connected to e-voting	Ms. Pallavi Mahtre, Manager, email: evoting@nsdl.com or call on 022 - 4886 7000

Members are informed that: (1) Members can vote only through remote e-voting facility provided by NSDL as no physical ballot form is being dispatched or will be accepted by the Company. (2) A member who has not received Postal Ballot Notice on their registered email address along with relevant Explanatory Statement and e-Voting instructions for remote e-Voting may obtain the same by sending an email to our RTA i.e. MUGF Intime India Private Limited at ahmedabad@in.mpmms.mugf.com and to the Company at investorconnect@anupengg.com. (3) A copy of the Postal Ballot Notice and the procedure for registration of email addresses of members are also available on the website of the Company at www.anupengg.com. The Postal Ballot Notice along with Explanatory Statement is also available on website of BSE Limited (www.bseindia.com) and National Stock Exchange of India Limited (www.nseindia.com) (**"Stock Exchanges"** where the equity shares of the Company are listed). (4) Ms. Ankita Patel, Designated Partner of ALAP & Co. LLP, Practicing Company Secretary (CP No. 16497) has been appointed as Scrutinizer for conducting remote e-voting process in accordance with the law and in a fair and transparent manner. (5) For any queries/grievances, in relation to voting through electronic means, members may contact Registrar and Transfer Agent (RTA) i.e. MUGF Intime India Private Limited at ahmedabad@in.mpmms.mugf.com, the Scrutinizer at alapanandcollp@gmail.com or the Company at investorconnect@anupengg.com. (6) The result of the voting by Postal Ballot shall be declared on or before Monday, 9th February, 2026. The results declared and the Scrutinizer's Report shall be made available at the Registered Office of the Company and on the Company's website and on the website of NSDL at www.evoting.nsdl.com besides being communicated to the Stock Exchanges where the Company's shares are listed.

Place: Ahmedabad
Date: 7th January, 2026

For The Anup Engineering Limited
Sd/-
Lay Desai
Company Secretary



PEGASUS ASSETS RECONSTRUCTION PRIVATE LIMITED
Corporate Office: 55-56, 5th Floor, Free Press House, Nariman Point, Mumbai-400021.
Regd. Office: 507, Datamal House, Jammalal Bajaj Road, Nariman Point, Mumbai-400021.

PUBLIC NOTICE FOR SALE BY E-AUCTION

Sale of Immovable Properties under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with Rule 8 and 9 of the Security Interest (Enforcement) Rules, 2002

Notice is hereby given to the public in general and in particular to the below mentioned Borrower(s), Co-Borrower(s) Guarantor(s) and Mortgagor(s) that the below described secured assets being immovable property mortgaged/ charged to the Secured Creditor, **Pegasus Assets Reconstruction Private Limited acting in its capacity as Trustee of Pegasus 2023 Trust 10 (Pegasus)**, having been assigned the debts of the below mentioned Borrower along with underlying securities interest by **Jana Small Finance Bank Ltd. ("Jana Bank")** vide Assignment Agreement dated 28/03/2024 under the provisions of the SARFAESI Act, 2002, are being sold under the provisions of SARFAESI Act and Rules thereunder on **"As is where is"**, **"As is what is"** and **"Whatever there is"** basis along with all known and unknown liabilities on **17/02/2026**.

The Authorized Officer of **Pegasus** has **taken possession** of the below described secured assets being immovable property on **20/07/2025** under the provisions of the SARFAESI Act and Rules there under.

The details of Auction are as follows:


Name of the Borrower(s), Co-Borrower(s) and Guarantor(s) and Mortgagor(s):	a) Maurya Jay Prakash Sidhnnath b) Kusum Jayprakash Maurya
Outstanding Dues for which the secured assets are being sold:	Rs.53,135.55 (Rupees Five Lakh Fifty Three Thousand One Hundred Thirty Five and Fifty Five Paise only) as of 17/01/2025 together with further interest, cost, charges and expenses thereon w.e.f. 18/01/2025 till the date of payment and realization as per notice under section 13(2) of SARFAESI Act. (Rs.7,33,406.76 (Seven Lakh Thirty Three Thousand Four Hundred and Six Rupees and Seventy Six Paise Only) outstanding as of 23/12/2025 together with further interest, cost, charges and expenses thereon w.e.f. 24/12/2025 till the date of payment and realization.)
Details of Secured Asset being Immovable Property which is being sold	Mortgaged by: Maurya Jay Prakash Sidhnnath & Kusum Jayprakash Maurya Non agriculture plot of land Mauje Sachin, Surat lying being and situated on the land bearing R.S. No.226/1+5/B & 226/8, Block No.231, Plots Paikl Plot No.70, 71 & 72, admeasuring 214.00 sq.mtrs. known as "VINDA ENCLAVE" Paikl building, Paikl Second Floor, Flat No.204, carpet area admeasuring 31.88 Sq.mtrs., i.e. 343.00 Sq.ft. & built up area admeasuring 34.57 sq.mtrs., Super Built up admeasuring 617.00 sq.ft.s, with undivided share of land at registration District & Sub-District Chounyasi District Surat. Boundaries: East: Other Plot, West: Flat No.203, North: Flat No.205, South: Road. CERSAI Sl.ID: 400055870385; Asset ID: 200056168863; LAN: 45259420002734 & 45259410000231;
Reserve Price below which the Secured Asset will not be sold (in Rs.):	Rs.5,03,000/- (Rupees Five Lakh Three Thousand Only)
Earnest Money Deposit (EMD):	Rs.50,300/- (Rupees Fifty Thousand Three Hundred Only)
Claims, if any, which have been put forward against the property and any other dues known to Secured creditor and value	Not Known
Inspection of Properties:	On 16.01.2026 from 11.30 A.M. to 03.00 P.M.
Contact Person and Phone No:	Mr. Pramod Jadhav - Sr. Manager - Mob. No.9923680690 Mr. Nilesh More - Sr. Manager - Mob. No.9004722468
Last date for submission of Bid:	16.02.2026 till 04:00 P.M.
Time and Venue of Bid Opening:	E-Auction/ Bidding through website (www.foreclosureindia.com) (https://bankauctions.in/) on 17.02.2026 from 11:00 A.M. to 12:00 Noon.

This publication is also **Thirty (30) days' notice** to the aforementioned Borrowers/ Co-Borrowers/ Guarantors under Rule 8 & 9 of the Security Interest (Enforcement) Rules, 2002.

For the detailed terms and conditions of the sale, please refer to Secured Creditor's website i.e. <http://www.pegasus-arc.com/assets-to-auction.htmlor> website (www.foreclosureindia.com) (<https://bankauctions.in/>).

Place: Gujarat
Date: 08.01.2026

Sd/- (Pramod Jadhav) Authorised Officer, Pegasus Assets Reconstruction Private Limited,
Acting in its capacity as the Trustee of the PEGASUS 2023 Trust 10



PEGASUS ASSETS RECONSTRUCTION PRIVATE LIMITED
Corporate Office: 55-56, 5th Floor, Free Press House, Nariman Point, Mumbai-400021.
Regd. Office: 507, Datamal House, Jammalal Bajaj Road, Nariman Point, Mumbai-400021.

PUBLIC NOTICE FOR SALE BY E-AUCTION

Sale of Immovable Properties under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with Rule 8 and 9 of the Security Interest (Enforcement) Rules, 2002

Notice is hereby given to the public in general and in particular to the below mentioned Borrower(s), Co-Borrower(s) Guarantor(s) and Mortgagor(s) that the below described secured assets being immovable property mortgaged/ charged to the Secured Creditor, **Pegasus Assets Reconstruction Private Limited acting in its capacity as Trustee of Pegasus 2023 Trust 10 (Pegasus)**, having been assigned the debts of the below mentioned Borrower along with underlying securities interest by **Jana Small Finance Bank Ltd. ("Jana Bank")** vide Assignment Agreement dated 28/03/2024 under the provisions of the SARFAESI Act, 2002, are being sold under the provisions of SARFAESI Act and Rules thereunder on **"As is where is"**, **"As is what is"** and **"Whatever there is"** basis along with all known and unknown liabilities on **27/01/2026**.

The Authorized Officer of **Jana Bank** has **taken possession** of the below described secured assets being immovable property on **15/08/2024** under the provisions of the SARFAESI Act and Rules thereunder and handed over the possession to Authorised officer acting in its capacity as Trustee of Pegasus 2023 Trust 10 (**"Pegasus"**).

The details of Auction are as follows:


Name of the Borrower(s), Co-Borrower(s) and Guarantor(s) and Mortgagor(s):	a) Thakkar Gaurav Rameshkumar b) Thakkar Bharatiben
Outstanding Dues for which the secured assets are being sold:	Rs.14,68,567/- (Rupees Fourteen Lakhs Sixty Eight Thousands Five Hundred and Sixty Seven Only) as of 19/12/2023 together with further interest, cost, charges and expenses thereon w.e.f. 20/12/2023 till the date of payment and realization as per notice under section 13(2) of SARFAESI Act. (Rs.20,99,646/- (Twenty Lakh Ninety Nine Thousand Six Hundred and Forty Six Rupees Only) outstanding as of 23/12/2025 together with further interest, cost, charges and expenses thereon w.e.f. 24/12/2025 till the date of payment and realization.)
Details of Secured Asset being Immovable Property which is being sold	Mortgaged by: Thakkar Gaurav Rameshkumar Immovable Commercial Bearing City Survey No.3290/1/00/5/5 Sheet No.35, Ground Floor, Shop No.05, total admeasuring 7.255 Sq.mtrs., known as Mangaldas Market, situated at Harij, Ta. Harij & Dist. Patan. Boundaries: North by: C.S.No.3290 Paikl & Shop No.4, South by: C.S.No.3290/2 Thaker Bhagvatprasad Vaikunthram etc-2, East by: C.S.No.3290 Paikl & Shop No.3, West by: Entry of this Property & Road than Mangaldas Market. CERSAI Sl.ID: 400067116985; Asset ID: 200068138688; LAN: 32109630000114;
Reserve Price below which the Secured Asset will not be sold (in Rs.):	Rs.13,46,000/- (Rupees Thirteen Lakh Forty Six Thousand Only)
Earnest Money Deposit (EMD):	Rs.1,34,600/- (Rupees One Lakh Thirty Four Thousand Six Hundred Only)
Claims, if any, which have been put forward against the property and any other dues known to Secured creditor and value	Not Known
Inspection of Properties:	On 16.01.2026 from 11.30 A.M. to 03.00 P.M.
Contact Person and Phone No:	Mr. Pramod Jadhav - Sr. Manager - Mob. No.9923680690 Mr. Nilesh More - Sr. Manager - Mob. No.9004722468
Last date for submission of Bid:	27.01.2026 till 04:00 P.M.
Time and Venue of Bid Opening:	E-Auction/ Bidding through website (www.foreclosureindia.com) (https://bankauctions.in/) on 28.01.2026 from 11:00 A.M. to 12:00 Noon.

This publication is also **Fifteen (15) days' notice** to the aforementioned Borrowers/ Co-Borrowers/ Guarantors under Rule 8 & 9 of the Security Interest (Enforcement) Rules, 2002.

For the detailed terms and conditions of the sale, please refer to Secured Creditor's website i.e. <http://www.pegasus-arc.com/assets-to-auction.htmlor> website (www.foreclosureindia.com) (<https://bankauctions.in/>).

Place: Gujarat
Date: 08.01.2026

Sd/- (Pramod Jadhav) Authorised Officer, Pegasus Assets Reconstruction Private Limited,
Acting in its capacity as the Trustee of the PEGASUS 2023 Trust 10



PEGASUS ASSETS RECONSTRUCTION PRIVATE LIMITED
Corporate Office: 55-56, 5th Floor, Free Press House, Nariman Point, Mumbai-400021.
Regd. Office: 507, Datamal House, Jammalal Bajaj Road, Nariman Point, Mumbai-400021.

PUBLIC NOTICE FOR SALE BY E-AUCTION

Sale of Immovable Properties under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with Rule 8 and 9 of the Security Interest (Enforcement) Rules, 2002

Notice is hereby given to the public in general and in particular to the below mentioned Borrower(s), Co-Borrower(s) Guarantor(s) and Mortgagor(s) that the below described secured assets being immovable property mortgaged/ charged to the Secured Creditor, **Pegasus Assets Reconstruction Private Limited acting in its capacity as Trustee of Pegasus 2023 Trust 10 (Pegasus)**, having been assigned the debts of the below mentioned Borrower along with underlying securities interest by **Jana Small Finance Bank Ltd. ("Jana Bank")** vide Assignment Agreement dated 28/03/2024 under the provisions of the SARFAESI Act, 2002, are being sold under the provisions of SARFAESI Act and Rules thereunder on **"As is where is"**, **"As is what is"** and **"Whatever there is"** basis along with all known and unknown liabilities on **16/02/2026**.

The Authorized Officer of **Jana Bank** has **taken possession** of the below described secured assets being immovable property on **06/10/2024** under the provisions of the SARFAESI Act and Rules thereunder and handed over the possession to Authorised officer acting in its capacity as Trustee of Pegasus 2023 Trust 10 (**"Pegasus"**).

The details of Auction are as follows:

Name of the Borrower(s), Co-Borrower(s) and Guarantor(s) and Mortgagor(s):	a) Solanki Mansukh Khimbhai b) Geetaben Mansukhbhai Solanki
Outstanding Dues for which the secured assets are being sold:	Rs.11,64,443/- (Rupees Eleven Lakhs Sixty Four Thousands Four Hundred and Forty Three Only) as of 19/01/2024 together with further interest, cost, charges and expenses thereon w.e.f. 20/01/2024 till the date of payment and realization as per notice under section 13(2) of SARFAESI Act on 25/01/2024 . (Rs.17,03,992/- (Rupees Seventeen Lakhs Three Thousand Nine Hundred and Ninety Two Only) outstanding as of 23/12/2025 together with further interest, cost, charges and expenses thereon w.e.f. 24/12/2025 till the date of payment and realization.)
Details of Secured Asset being Immovable Property which is being sold	Mortgaged by: Solanki Mansukh Khimbhai All the piece and parcel of Immovable Property bearing Plot No.9, constructed on land admeasuring area 95.42 Sq.mtrs., (Shreenathji Society) of Revenue Survey No.100 of B/h. N.G. Mill, Moje Manavadar, Taluka Manavadar Dist. Junagadh. Bounded by: East: Adj. Property of Plot No.10, West: Adj. Road, North: Adj. Road, South: Adj. Land of R.S. No.99. CERSAI Sl.ID: 40005537959; Asset ID: 200055625760; LAN: 31529430000482;
Reserve Price below which the Secured Asset will not be sold (in Rs.):	Rs.9,66,000/- (Rupees Nine Lakh Sixty Six Thousand Only)
Earnest Money Deposit (EMD):	Rs.96,600/- (Rupees Ninety Six Thousand Six Hundred Only)
Claims, if any, which have been put forward against the property and any other dues known to Secured creditor and value	Not Known
Inspection of Properties:	On 16.01.2026 from 11.30 A.M. to 03.00 P.M.
Contact Person and Phone No:	Mr. Pramod Jadhav - Sr. Manager - Mob. No.9923680690 Mr. Nilesh More - Sr. Manager - Mob. No.9004722468
Last date for submission of Bid:	16.02.2026 till 04:00 P.M.
Time and Venue of Bid Opening:	E-Auction/ Bidding through website (www.foreclosureindia.com) (https://bankauctions.in/) on 17.02.2026 from 11:00 A.M. to 12:00 Noon.

This publication is also **Thirty (30) days' notice** to the aforementioned Borrowers/ Co-Borrowers/ Guarantors under Rule 8 & 9 of the Security Interest (Enforcement) Rules, 2002.

For the detailed terms and conditions of the sale, please refer to Secured Creditor's website i.e. <http://www.pegasus-arc.com/assets-to-auction.htmlor> website (www.foreclosureindia.com) (<https://bankauctions.in/>).

Place: Gujarat
Date: 08.01.2026

Sd/- (Pramod Jadhav) Authorised Officer, Pegasus Assets Reconstruction Private Limited,
Acting in its capacity as the Trustee of the PEGASUS 2023 Trust 10

E-AUCTION SALE NOTICE
MANTHAN BROADBAND SERVICES PRIVATE LIMITED (IN LIQUIDATION)
CIN : U64203WB2002PTC094700
Registered Office : 6 G C Avenue, 3Rd Floor, Kolkata, West Bengal, India, 700013
Liquidator : Mr Sandip Mitra
Liquidator's Office : 53/C, Harish Mukherjee Road, Kolkata - 700025
Email ID : liquidation.manthan@gmail.com, **Contact No. :** 9830344450

Notice is hereby given to the public at large, inviting bids for the sale of the assets (described in the table below) owned by **M/s. Manthan Broadband Services Private Limited (in liquidation)** which forms a part of the liquidation estate of the Corporate Debtor, in accordance with the provisions of the Insolvency and Bankruptcy Code, 2016 ("IBC") read with the regulations framed thereunder, on an **"AS IS WHERE IS BASIS, AS IS WHAT IS BASIS, WHATEVER THERE IS BASIS AND NO RECOURSE BASIS"**.

The auction will take place through the online e-auction service provider, Baanknet auction platform at <https://bbi.baanknet.com>.

SCHEDULE OF IMPORTANT DATES FOR THE E-AUCTION				
Last date and time for submission of requisite forms, Affidavits, Declarations, etc. on the BAANKNET portal	29 January 2026, up to 5 PM			
Last date and time for submission of EMD on the BAANKNET portal	29 January, up to 5 PM			
Date and Time of the E-Auction	31 January 2026 from 11.00 AM to 3:00 PM (Unlimited time extension of 5 minutes each)			

Sr. No.	Block	Details of Assets	Reserve Price (Rs)	Earnest Money Deposit (Rs)	Incremental Value (Rs)
1	Block A	Land along with assets at Mouza - Tajpur, J.L. No. 244, P.S. - Ramnagar, East Medinipur, West Bengal (under Digha Sankarpur Development Authority), as per records, having an aggregate area of 3 acres as per sale deeds	3,55,00,000	35,50,000	10,00,000
2	Block B	Land along with assets at Mouza - Tajpur, J.L. No. 244, P.S. - Ramnagar, East Medinipur, West Bengal (under Digha Sankarpur Development Authority), as per records, having an aggregate area of 10.095 acres as per sale deeds. (Original Title deeds not in possession of Liquidator)	11,95,00,000	1,19,50,000	15,00,000
3	Block C	Land along with assets at Mouza - Tajpur, J.L. No. 244, P.S. - Ramnagar, East Medinipur, West Bengal (under Digha Sankarpur Development Authority), as per records, having an aggregate area of 13.095 acres as per sale deeds. (Original Title deeds admeasuring only 3 Acres in possession of the Liquidator)	15,50,00,000	1,55,00,000	20,00,000


Major Terms and Conditions of the E-auction are as follows :

- The intending bidders are required to register through <https://bbi.baanknet.com> by using their mobile number and email ID. Contact for support: support.baanknet@psballance.com / Mobile No. +91 8291220220. The Liquidator will not be responsible for any technical glitches on the portal.
- The Liquidator, in consultation with the Stakeholders' Consultation Committee, shall hold the absolute right with reference to preference of selection between Block A, Block B or Block C.
- The Complete E-Auction Process Document, to be read in conjunction with this notice including the Asset Details, Declaration and Undertaking Form, General Terms and Conditions of Online Auction Sale, and Payment Terms-is available on the website <https://bbi.baanknet.com>.
- The intending bidders shall submit an undertaking that they do not suffer from any ineligibility under section 29A of the Code to the extent applicable and that if found ineligible at any stage, the Earnest Money Deposited shall be forfeited.
- Intending bidders are required to submit the prequalification documents, Undertaking under Section 29A and EMD through the E-auction Platform, i.e., <https://bbi.baanknet.com>.
- The EMD must be deposited by using the bidder's own e-wallet account on the portal. EMD shall not bear any interest.
- In case the highest bidder is found ineligible, the liquidator may, in consultation with the consultation committee, declare the next highest bidder as the successful bidder after following the same process as provided under clause (12A) to clause (12E) of the Liquidation Regulations under Schedule I.
- Intending bidders shall conduct independent due diligence, at their own cost, regarding the possession, ownership, title, and any outstanding dues related to the property, including local taxes, electricity, water charges, or other liabilities, before participating in the E-auction and shall satisfy themselves accordingly.
- The Successful Bidder shall bear the applicable stamp duties/lease transfer charge, fees, taxes, legal expenses, etc. and all the local taxes, duties, rates, assessment charges, fees, maintenance charges, etc., including arrears if any, in respect of the property put on auction.
- It is clarified that this invitation purports to invite prospective bidders and does not create any kind of binding obligation on the part of the Liquidator or the Company to effectuate the sale. The Liquidator reserves the right to cancel or modify the e-auction process and/or not to accept and/or disqualify any interested party / potential investor/bidder without assigning any reason and without any liability.


Sandip Mitra
Liquidator - Manthan Broadband Services Private Limited
Regn. No: IBB/PA-001/P-P00497/2017-18/10885
AFA Valid up to 31/12/2026


Date : 08/01/2026
Place : Kolkata


Regional Aspirations, Global Ambitions




Days To Go






Shri Narendra Modi
Hon'ble Prime Minister



Shri Bhupendra Patel
Hon'ble Chief Minister, Gujarat


11th - 12th January, 2026
Rajkot
www.vibrantgujarat.com


Government of Gujarat










Ahmedabad




epaper.financialexpress.com

૨૦૨૫માં એફપીઆઇએ ૧૬ ક્ષેત્રોમાં ૩૦ અબજ ડોલરનું રોકાણ કર્યું

એનએસડીએલ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ફોરેન પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઈ)એ કેવેનર ૨૨ વર્ષ ૨૦૨૨ પમાં અર્ધતંત્રના મહત્વના ૧૬ ક્ષેત્રોમાં લગભગ ૩૦ અબજ યુએસ ડોલર એટલે કે રૂપિયા ૨.૧૨ લાખ કરોડની કિંમતના ઇકિવટી શેરોનું વેચાણ કર્યું છે.ફોરેન પોર્ટફોલિયો રોકાણકારો આઇટી સેક્ટરની કંપનીઓમાં સૌથી વધુ વેચનાર હતા, જેમણે ૮.૬ અબજ ડોલરની કિંમતના ઇકિવટી શેરોનું વેચાણ કર્યું છે.ત્યારબાદ ફાસ્ટ મુવિંગ કન્સ્યુમર ગુડ્ઝ (એફએમસીજી) સેક્ટરની કંપનીઓના ૪.૨ અબજ અમેરિકન ડોલરના ચોખ્ખા આઉટફ્લો રહ્યો છે.

વિદેશી રોકાણકારો દ્વારા પાવર સેક્ટરની કંપનીઓના ૩ અબજ યુએસ ડોલરના ઇકિવટી શેરોનું ચોખ્ખું વેચાણ કર્યું છે.



-કિશોર કદમ્

રૂપિયો ડોલર સામે ૩૧ પૈસા ઉછળીને ૮૯.૮૭ પર બંધ રહ્યો

પીટીઆઈ

મુંબઈ, તા. ૭

વેશ્વિક ફૂડ તેલના ભાવમાં ઘટાડો અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા સંબવિત હસ્તક્ષેપને કારણે બુધવારે ડોલર સામે રૂપિયો ૩૧ પૈસાના નોંધપાત્ર વધારા સાથે ૮૯.૮૭ પર બંધ રહ્યો હતો. ઈન્ટરબેન્ક ફોરેન એક્સચેન્જ ખાતે ડોલર સામે રૂપિયો ૯૦.૨૦એ ખુલ્યો હતો, તે પછી દિવસ દરમિયાન ૯૮.૭૫થી ૯૦.૨૩ની રેન્જમાં ટ્રેડ થઈને અંતે ૩૧ પૈસાના વધારા સાથે ૮૯.૮૭ પર બંધ રહ્યો હતો. ચાર

દિવસના સતત ઘટાડા પછી મંગળવારે ડોલર સામે રૂપિયો ૧૨ પૈસાના વધારા સાથે ૯૦.૧૮ પર બંધ રહ્યો હતો. આરબીઆઈએ ૯૦.૨૩ના સ્તરથી ડોલરનું વેચાણ શરૂ કરતા રૂપિયો મજબૂત થયો હતો. ડોલર સામે રૂપિયા ૮૯.૫૦થી ૯૦.૫૦ની રેન્જમાં ટ્રેડ થાય તે કોલ લેવું થોડુંક મુશ્કેલ છે, આ રેન્જ જાન્યુઆરી માટે રાખવામાં આવી છે, તેમ ફેનરેક્સ ટ્રેડરી એડવાર્ટીઝર્સ એલએલપીના એકિઝક્યુટિવ ડિરેક્ટર અને ટ્રેડરી વડા અનિલ કુમાર ભણસાલીએ જણાવ્યું હતું. આ દરમિયાન ડોલર ઈકેપની દીસીએસના જ બજાર સાથે ૯૮.૬૫ પર ક્વોટ થયો હતો.

જ્યારે છ ચલણોના બાસ્કેટમાં ગ્રીનબેક મજબૂત થયો હતો. વૈશ્વિક તેલ બેન્ચમાર્કમાં બ્રેન્ટ ફૂડ વાયદો ૦.૯૯ ટકાના ઘટાડા સાથે ૬૦.૧૦ પર ક્વોટ થયો હતો. સ્થાનિક ઈકિવટી બજારના મોરચે ૩૦ શેરોનો બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ ૧૦૨.૨૦ પોઈન્ટ્સના ઘટાડા સાથે ૮૪,૯૬૧.૧૪ પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઈન્ડેક્સ ૩૭.૮૫ પોઈન્ટ્સના ઘટાડા સાથે ૨૬,૧૪૦.૭૫ પર બંધ રહ્યો હતો.

શેરબજારના આંકડા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ મંગળવાર સમયરેખામાં ઈકિવટીમાંથી રૂપિયા ૧૦૭.૬૩ કરોડની વેચવાલી કરી હતી.

તાતા ગ્રૂપના બજાર મૂલ્યમાં એક વર્ષમાં રૂપિયા ૫ લાખ કરોડનો ઘટાડો નોંધાયો

મુંબઈ, તા. ૭
ગત વર્ષ તાતા ગ્રૂપ માટે મુશ્કેલીનો વર્ષ રહ્યો હતો, જેમાં ગ્રૂપના બજાર મૂલ્યમાં તીવ્ર ઘટાડાની સાથે મુખ્ય વ્યવસાયમાં પણ નુકસાનનો સામનો કરવા પડ્યો હતો. કેપિટલલાઈન પાસેથી પ્રાપ્ત થયેલા આંકડા પ્રમાણે તાતા ગ્રૂપની ૨૪ લિસ્ટેડ કંપનીઓમાંથી ૧૮ કંપનીઓમાં ગત વર્ષે ૬૦ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.

હતો. અને તેમનું બજાર મૂલ્ય રૂપિયા ૫,૧૪,૬૧૯ કરોડ થટ્યું હતું. ગ્રૂપની અગ્રણી કંપની તાતા કન્સલ્ટન્સી સર્વિસમાં (ટીસીએસ) સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આઈટી ક્ષેત્રની અગ્રણી કંપની ટીસીએસના જ બજાર મૂલ્યમાં રૂપિયા ૩,૨૦,૦૩૮ કરોડનો ઘટાડો જોવા મળ્યો છે. ૫ જાન્યુઆરીએ ટીસીએસનું બજાર મૂલ્ય રૂપિયા ૧૧,૬૩,૧૦૭ કરોડ હતું જ્યારે અગાઉના વર્ષના

સમાન સમયગાળામાં ટીસીએસનું બજાર મૂલ્ય રૂપિયા ૧૪,૮૩,૧૪૫ કરોડ રહ્યું હતું, જ્યારે આ સમયગાળા દરમિયાન કંપનીના શેરનો ભાવમાં ૨૨ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ઉછળીનય છે કે, એચ-૧બી વિઝની ક્ષીમાં વધારો અને અમેરિકા દ્વારા ટેરિફમાં વધારો કરવામાં આવતા અને ગ્રાહકની ફાળવણીમાં ઘટાડો જેવા મુખ્ય કારણો છે. એચએસબીસી દ્વારા જારી કરેલા તાજેતરના અહેવાલને

ફાયનાન્સિયલ એક્સપ્રેસે ક્વોટ કરતા જણાવ્યું હતું કે, આઈટી ક્ષેત્ર હવે લાંબાગાળા બે આંકડાની વૃદ્ધિ હાંસલ કરનાર ક્ષેત્ર રહેશે નહિં અને શેરોનું વળતર અગાઉના વર્ષની તુલનાએ ઓછું રહેશે. આ વર્ષે તેના કોમર્શિયલ બ્લોક એકમના વિભાજન પછી તાતા મોટર પેસેન્જર બ્લિકલના (પીસી) વિભાજન પછી તેણે પણ તેનું અનુકરણ કર્યું છે. શેરમાં ૫૩ ટકાના ઘટાડા વચ્ચે તાતા મોટર્સે પીવીએ ફક્ત તેના માર્કેટ કેપમાંથી રૂપિયા ૧,૫૩, ૪૮૧

કરોડનું ધોવાણ થયું હતું. સાયબર એટેક, ટેરિફ સંબંધિત ખર્ચ, પ્રતિકૂળ ફોરેક્સ અને ઊંધા વોન્ટ્રી ખચને કારણે જેએલઆર માટે ઉત્પાદન નુકસાન સ્ટોક પર ભારે પડ્યું છે. મેનેજમેન્ટએ ભુરાજકીય તણાવ પર પ્રકાશ પાડ્યો છે, જેમાં ટેરિફ અનિશ્ચિતતા અને સતત જોખમી સપ્લાય ચેઇન, જેએમ ફાયનાન્સિયલને પ્રોત્સાહન અને નવેમ્બરમાં રૂપિયા ૩૬૫ની ટાગેટ પ્રાઈસ રાખવામાં આવી છે.

વેલસ્પન કોર્પની વૈશ્વિક ઓર્ડરબુક રૂા.૨૩,૦૦૦ કરોડને પાર થઇ

પીટીઆઇ

નવી દિલ્હી, તા. ૭

વેલસ્પન કોર્પે ભારત બહાર નવા પાઇપ સપ્લાય કોન્ટ્રાક્ટ પ્રાપ્ત કરવાને પગલે આજે જણાવ્યું હતું કે તેની વૈશ્વિક ઓર્ડરબુક રૂા.૨૩,૦૦૦ કરોડના સ્તરને પાર કરી ગઇ છે. કંપનીએ એક્સચેન્જને એક

નિયમનકારી યાદીમા જણાવ્યું હતું કે તેને અમેરિકામા પુરવઠા માટે મોટા વ્યાસની કોટેડ લાઇન પાઇપના પુરવઠા માટે નવો નિકાસ ઓર્ડર મળ્યો છે. આ નવા ઓર્ડર સાથે અમારી કુલ વૈશ્વિક ઓર્ડર બુક હવે રૂા.૨૩,૪૬૦ કરોડ (૨.૬ અબજ ડોલર) છે, જે ભારત અને યુએસએ બંને અસ્કયામતોમા સ્પષ્ટ બિઝનેસ દ્રશ્યતા અને સાતત્ય આપે છે, તેમ તેમણે ઉમેરતા

જણાવ્યું હતું. ઉપરોક્ત ઓર્ડર બુક નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬, નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭ અને નાણાંકીય વર્ષ ૨૦૨૭-૨૮ દરમિયાન અમલમા મુકવામા આવશે. વેલસ્પન વર્લ્ડની મુખ્ય કંપની વેલસ્પન કોર્પ લિમિટેડ (બ્લ્યુસીએલ) વૈશ્વિક સ્તરે મોટા વ્યાસની પાઇપના સૌથી મોટા ઉત્પાદકોમાથી એક છે.

ધી મહેસાણા અર્બન કો-ઓપ.બેન્ક લિ. મહેસાણા (મલ્ટી સ્ટેટ શિક્સલ બેન્ક)

હેડ ઓફિસ : કોપોરેટ બિલ્ડિંગ, હાથવે, મહેસાણા-૩૮૪૦૦૨

ફોન નં. (૦૨૭૬૬૨) ૨૫૭૨૩૩, ૨૫૭૨૩૪

માંગણા નોટિસ

નાણાકીય સંપત્તિઓની સુરક્ષા અને પુનર્નિર્માણ અને સુરક્ષા હિત અધિનિયમ, 2002 ના

અમલીકરણની કલમ 13 (2) હેઠળ સૂચના (અર્થ) 'અધિનિયમ' તરીકે ઓળખાતી

આથી સૂચના આપવામાં આવી છે કે સુરક્ષા અને અચ્યુત પટેજિંગ પ્રાઇવેટ લિમિટેડ, બેંક પાસેથી મેળવેલી લોન સુવિધાઓના મુકાબલે અને વ્યાજની ચૂકવણીમાં ડિફોલ્ટ થયા છે અને લોનને નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPA) તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. રજા બેંક અને તેના ગેરંટરોને તેમના છેલ્લા જાણીતા સરનામે સિસ્કોરિટાઈઝેશન અને રિકન્સ્ટ્રક્શન ઓફ એન્ડ એનોન્સિમેન્ટ ઓફ સિસ્કોરિટી ઈન્ટરેસ્ટ એક્ટ 2002 ની કલમ 13 (2) હેઠળ નોટિસ જારી કરવામાં આવી હતી, પરંતુ નીચેના રજા બેંકના રિડિસ્કંટ/ગેરંટરોને જારી કરાયેલ નોટિસ પરત કરવામાં આવી છે/અનમત કરવામાં આવી છે અને નીચી રજા બેંકના રિડિસ્કંટ/ગેરંટરોને આ જરૂરે સૂચના દ્વારા જાણ કરવામાં આવે છે.

ક્રમ નં.	ડિરેક્ટર/ગેરંટરનું નામ અને સરનામું	નોટિસની તારીખ	NPA ની તારીખ	રકમ બાકી
1	અચ્યુત પટેજિંગ પ્રાઇવેટ લિમિટેડ (ઉપાર લેનાર) સર્વે નંબર- 2108/1, ગામ- ઉનાવા, તા-ઉંઝા, જિ.-મહેસાણા-384160	1૯-1૨-૨૦૨૫	૩૦-૦૯-૨૦૨૩	રૂ. ૩,૪૧,૩૮,૯૭૮.૦૦ (રૂપિયા ત્રણ કરોડ એકતાલીસ લાખ આડસીસ હજાર નવસો ઈશોરે પુરા.) ૩૦/૧૧/૨૦૨૫ સુધી
૨	હેમંતકુમાર પ્રહલાદભાઈ પટેલ (ડિરેક્ટર) ડી-70૪, પોપુલ્યર પેરેડાઈઝ, વિશ્વાસ સિટી 5 પાસે, ગોતા, અમદાવાદ-382481			
૩	દિલીપકુમાર પ્રહલાદભાઈ પટેલ (ડિરેક્ટર) Q-404, અભિકેક એપાર્ટમેન્ટ, ગણેશ વિદ્યાલયની સામે, ન્યુ વાડજ રોડ, વાડજ, અમદાવાદ-380013			
૪	કૃષ્ણકાંત ગોસ્વમીભાઈ પટેલ (જામીનદાર) Q 402 અભિકેક એપાર્ટમેન્ટ, ગણેશ વિદ્યાલયની સામે, નવા વાડજ, નારણપુરા વિસ્તાર, અમદાવાદ-380013			
૫	હરેશભાઈ પ્રહલાદભાઈ પટેલ (જામીનદાર) 71 આલોક બંગ્લોઝ, ઉંઝા-સિદ્ધપુર રોડ, ઉંઝા-384170			
૬	બાબુભાઈ જોઈનારામ પટેલ (જામીનદાર) 70 આલોક બંગ્લોઝ, હાઇવે, ઉંઝા-384170			
૭	હર્ષાબેન પ્રહલાદભાઈ પટેલ (જામીનદાર) ગામ-ઉનાવા, તા-ઉંઝા જિ: મહેસાણા			
૮	ઉષાબેન પ્રહલાદભાઈ પટેલ (જામીનદાર) ગામ-ઉનાવા, તા-ઉંઝા જિ: મહેસાણા			
૯	ભાવનાબેન પ્રહલાદભાઈ પટેલ (જામીનદાર) ગામ-ઉનાવા, તા-ઉંઝા જિ: મહેસાણા			
10	દ્રુસાબેન પ્રહલાદભાઈ પટેલ (જામીનદાર) ગામ-ઉનાવા, તા-ઉંઝા જિ: મહેસાણા			

અમલમાં મુકવામાં આવનારી સુરક્ષિત સંપત્તિઓની વિશ્લક્તો/સરનામાની વિગતો

ક્રમ નં.	સ્થાવર વિશ્લક્તોની વિગતો
1	વિભક્તના માલિકઃ હર્ષાબેન પ્રહલાદભાઈ પટેલ, હરેશભાઈ પ્રહલાદભાઈ પટેલ, ઉષાબેન પ્રહલાદભાઈ પટેલ, દિલીપભાઈ પ્રહલાદભાઈ પટેલ, ભાવનાબેન પ્રહલાદભાઈ પટેલ, દ્રુસાબેન પ્રહલાદભાઈ પટેલ, વિભક્તનું વર્ણનઃ બિન-પેતી જમીન (લે-આઉટ નકશામાં મંજૂર કરાયેલ ઔદ્યોગિક હેતુ માટે) પરાવતી વિશ્લક્ત, જેમાં રેવન્યુ બ્લોક નં. ૨૧૦૮/૧, ૪૮૮1.૦૦ મેરસ મીટર, બાંધકામ માટે ૨૯૩૨.૪૮ છે. ગામ- ઉંઝા, જિલ્લા મહેસાણાની હદમાં સ્થિત છે. વિશ્લક્તની સીમા:- ઉત્તરઃ સર્વે નં.૨૧૧૦, દક્ષિણઃ સર્વે નં.૨૧૦૮/૨, પૂર્વઃ સર્વે નં.૨૧૦૮/૩ અને ૨૧૦૭, પશ્ચિમઃ સર્વે નં.૨૧૦૯
2	વિભક્તના માલિકઃ બાબુભાઈ જોઈનારામ પટેલ વિભક્તનું વર્ણનઃ મહેસૂલ સર્વે નં. ૭૫૩/૧, ૭૫૩/૨, ૭૫૩/૭ જમીન પરાવતી સ્થાવર વિશ્લક્તનો તે ટુકડો અને ભાગ ટી.પી. સ્કીમ નં. ૫ માં સ્થિત છે, જ્યાં કાંઈનમ પ્લોટ નં. ૧૭૩ અને ૧૭૪ ઉપરોક્ત જમીન પર આવેલા છે. ઉપરોક્ત જમીન પર બ્લોક નં. ૭૦ પર રહેણાંક હેતુ માટે બાંધકામ હાથ પરવામાં આવ્યું છે, જેમાં બાંધકામ કરેલ વિસ્તાર ૧.૪૦ ચોરસ મીટર, માર્જિન વિસ્તાર ૮૪.૩૮ છે અને કુલ વિસ્તાર ૧૪૫.૭૮ છે. જે ચોજે ઉંઝા, તા: ઉંઝા, જિલ્લો-મહેસાણા ખાતે સ્થિત છે. વિશ્લક્તની સીમા:- ઉત્તરઃ બ્લોકની મધ્યમાં 6.00 મીટર પહોળો સ્તંભો, દક્ષિણઃ બ્લોકની ડાબી ખુણી જમીન પછી F.P.177, પૂર્વઃ બ્લોક નં. 71, પશ્ચિમઃ બ્લોકની ખુણી જમીન પછી મધ્ય કોમન પ્લોટમાં

નોટિસની અવેજી સેવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. ઉપરોક્ત રજા બેંકના/નિર્દેશકો/ગેરંટરોએ આ સૂચનાના પ્રકાશની તારીખથી 60 દિવસની અંદર બાકી રકમ ચૂકવવા માટે હકેવામાં આવે છે, જો તેમાં નિષ્ફળ જાય તો આ સૂચનાની તારીખથી 60 દિવસની મુદત પૂરી થયા પછી નાણાકીય સંપત્તિઓનું સિસ્કોરિટાઈઝેશન અને રિકન્સ્ટ્રક્શન અને એનોન્સિમેન્ટ ઓફ સિસ્કોરિટી ઈન્ટરેસ્ટ એક્ટ, 2002 ની કલમ 13 ની પેરા ૩ કલમ (4) હેઠળ આગળના પગલાં લેવામાં આવશે. સુરક્ષિત સંપત્તિઓને લિટીમ કરવા માટે ઉપલબ્ધ સમયના સંદર્ભમાં, SARFAESI કાયદાની કલમ 13 ની પેરા ૬ કલમ (8) ની જોગવાઈઓ તરફ ધ્યાન આકર્ષિત કરવામાં આવે છે.


તારીખ: ૦૫.૦૧.૨૦૨૫
સ્થળ: મહેસાણા
અધિષ્ઠાત્ર અધિકારી,
ધી મહેસાણા અર્બન કો.ઓપ.બેન્ક લિ.

જીવન વીમા કંપનીઓ મિશ્ર પ્રદર્શન નોંધાવે તેવી શક્યતા

નારાયણન વી

જીવન વીમા કંપનીઓ ત્રીજા ત્રિમાસિકમાં મિશ્ર પ્રદર્શન નોંધાવે તેવી અપેક્ષા છે. જીએસટી દરમાં ઘટાડાથી પ્રીમિયમ વૃદ્ધિ અને નફાકારકતામાં વધારો થવાની અપેક્ષા છે, પરંતુ ઉલ્લેખ વિશ્લેષકોના મતે, ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી) ના નુકસાનને કારણે માર્જિન દબાણ હેઠળ આવી શકે છે. મોતિલાલ ઓસ્વાલ ફાઇનાન્સિયલ સર્વિસિસના વિશ્લેષકોના મતે, જીવન વીમા કંપનીઓ પ્રીમિયમમાં વાર્ષિક ધોરણે ૧૪ ટકા અને કર પછીના નફામાં (પીએટી) ૧૭ ટકા વૃદ્ધિ નોંધાવે તેવી અપેક્ષા છે.

જીવન વીમા કંપનીઓએ નવેમ્બરમાં નવા વ્યવસાય પ્રીમિયમ (એનબીપી) માં વાર્ષિક ધોરણે ૨૩ ટકા નો ઉછળો નોંધાવ્યો હતો, જે ચાલુ નાણાકીય વર્ષમાં સૌથી વધુ છે, જે રૂપિયા ૩૧,૧૧૯.૬૪ કરોડ થયો હતો. સરકારે તમામ




વ્યક્તિગત જીવન વીમા પ્રીમિયમ પર જીએસટી મુક્તિ આપ્યા પછી આ વૃદ્ધિ થઈ છે. ખાનગી જીવન વીમા કંપનીઓએ ઓક્ટોબર અને નવેમ્બરમાં જીએસટીના તર્કસંગતકરણને કારણે અનુક્રમે વ્યક્તિગત વાર્ષિક પ્રીમિયમ સમકક્ષ (એપીઈ) માં ૧૫ ટકા અને ૨૮ ટકા

વાર્ષિક વૃદ્ધિ નોંધાવી હતી.

મોતીલાલ ઓસ્વાલ વિશ્લેષકે ત્રીજા ત્રિમાસિકમાં એચડીએફસી લાઇફ, આઇસીઆઇસીઆઇ મ્યુપ્રિન્સિયલ લાઇફ, મેક્સ ફાઇનાન્સિયલ અને એસબીઆઇલાઇફ ઇન્શ્યુરન્સ માટે વાર્ષિક ધોરણે એપીઈ વૃદ્ધિ બે આંકડામાં

આઇટીબીઆઈ બેંકના શેરોનું વેચાણ ૨૦૨૭-૨૮માં કરાશે

પ્રશાંત સાહુ



વિનિવેશ અને સંપત્તિ મુદ્દીકરણ માટેના રૂપિયા ૪૭,૦૦૦ કરોડના સંયુક્ત લક્ષ્યાંક સામે ઘટાડો થઈ શકે છે. ચાલુ નાણાકીય વર્ષમાં, ડિસઇન્વેસ્ટમેન્ટની રકમ માત્ર ૮,૭૬૮ કરોડ રહી છે, જ્યારે એસેટ મોનોટાઇઝેશનની આવક સ્વેન્ટરીને નિશ્ચિત રીતે કહી શકાતી નથી.સંબવિત

વિલંબ છતાં, અધિકારીઓએ સંકેત આપ્યો હતો કે નાણાકીય રિવમેટિક પસની અસર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) તરફથી અપેક્ષા કરતા વધુ ડિવિડન્ડ અને અનેક ખર્ચ હેડમાં સંબવિત બચત દ્વારા શોષાઈ જશે. સોમવારે બીએસઈ પર આઇટીબીઆઈ બેંકના શેર ૧૧૦.૮૫

પર બંધ થયા, જે પાછલા બંધ કરતા ૩.૪૮ ટકા ઓછા છે. અધિકારીઓએ અગાઉ જુલાઈ ૨૦૨૫ માં સૂચવ્યું હતું કે આ વ્યવહાર ઓક્ટોબર ૨૦૨૫ સુધીમાં પૂર્ણ થઈ શકે છે. જોકે, ત્યારથી બિડર ગતિશીલતામાં ફેરફાર સક્રિત અનેક પરિબળોને કારણે પ્રક્રિયા લંબાઈ રહી છે.એક મુખ્ય વિકાસ જે પ્રક્રિયાને જાટિલ બનાવે છે તે એમિરેટ્સ એનબીડી દ્વારા ઓક્ટોબરમાં જાહેરાત કરવામાં આવી હતી કે તે ખાનગી ચિરાણકર્તા બ્લંક બેંકમાં ૬૦ ટકા સુધીનો હિસ્સો લગભગ ૩ અબજ ડોલર (લગભગ રૂપિયા ૨૭,૦૦૦ કરોડ) માં હસ્તગત કરશે. આ સોદો, જેમાં પ્રેક્ટરન્સિયલ શેર ઇશ્યુ અને ફરજિયાત ઓપન ઓફરનો સમાવેશ થાય છે, તે નિયમનકારી મંજૂરીઓના આવીન છે અને ભારતના ખાનગી બેંકિંગ ક્ષેત્રમાં સૌથી મોટું વિદેશી રોકાણ હશે.

આ પગલા અછી, વિશ્લેષકો હવે એમિરેટ્સ એનબીડી ને આઇટીબીઆઈ બેંક માટે ઉત્કૃષ્ઠ બિડર તરીકે જોતા નથી.

અન્ય શોર્ટલિસ્ટેડ બિઝ્નેસમાં સીએસબી બેંકના પ્રમોટર ફેરેફેક્સ ઇન્ડિયા હોલિંડિઝ અને કોટક મહિન્દ્રા બેંકનો સમાવેશ થાય છે. સુત્રોએ જણાવ્યું હતું કે હિસ્સાના વેચાણ અને મૂલ્યાંકન સંબંધિત પ્રક્રિયાઓ ચાલુ છે, જેના કારણે પૂર્ણ થવા માટે ચોક્કસ સમયરેખા પૂરી પાડવી મુશ્કેલ બની રહી છે. ભૂતકાળના વ્યુહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટના દાખલા સૂચવે છે કે જો નાણાકીય બિડ સૂંક સમયમાં પ્રાપ્ત થાય તો પણ, ૩૧ માર્ચ સુધીમાં રકમ ન પણ આવે. એર ઇન્ડિયાના કિસ્સામાં, ઓક્ટોબર ૨૦૨૧ માં વિજેતા બિડને ક્રેડિટનેટ મંજૂરી અને જાન્યુઆરી ૨૦૨૨ માં સોદો પૂર્ણ થવા વચ્ચે લગભગ ચાર મહિના વીતી ગયા.

આઇટીબીઆઇ બેંક એક નિયમનકારી ચિરાણકર્તા હોવાથી, અગાઉના નિયમનકારી મંજૂરીઓની જરૂ રિયાતને કારણે પ્રક્રિયામાં વધુ સમય લાગી શકે છે.

જાનનાન્સિયલ એક્સપ્રેસે ક્વોટ કરતા જણાવ્યું હતું કે, આઈટી ક્ષેત્ર હવે લાંબાગાળા બે આંકડાની વૃદ્ધિ હાંસલ કરનાર ક્ષેત્ર રહેશે નહિં અને શેરોનું વળતર અગાઉના વર્ષની તુલનાએ ઓછું રહેશે. આ વર્ષે તેના કોમર્શિયલ બ્લોક એકમના વિભાજન પછી તાતા મોટર પેસેન્જર બ્લિકલના (પીસી) વિભાજન પછી તેણે પણ તેનું અનુકરણ કર્યું છે. શેરમાં ૫૩ ટકાના ઘટાડા વચ્ચે તાતા મોટર્સે પીવીએ ફક્ત તેના માર્કેટ કેપમાંથી રૂપિયા ૧,૫૩, ૪૮૧ કરોડનું ધોવાણ થયું હતું. સાયબર એટેક, ટેરિફ સંબંધિત ખર્ચ, પ્રતિકૂળ ફોરેક્સ અને ઊંધા વોન્ટ્રી ખચને કારણે જેએલઆર માટે ઉત્પાદન નુકસાન સ્ટોક પર ભારે પડ્યું છે. મેનેજમેન્ટએ ભુરાજકીય તણાવ પર પ્રકાશ પાડ્યો છે, જેમાં ટેરિફ અનિશ્ચિતતા અને સતત જોખમી સપ્લાય ચેઇન, જેએમ ફાયનાન્સિયલને પ્રોત્સાહન અને નવેમ્બરમાં રૂપિયા ૩૬૫ની ટાગેટ પ્રાઈસ રાખવામાં આવી છે.

વેલસ્પન કોર્પની વૈશ્વિક ઓર્ડરબુક

રૂા.૨૩,૦૦૦ કરોડને પાર થઇ

લીમીઆઇ

દ્દાવી દિલ્હી, તા. ૭

વેલસ્પન કોર્પ ભારત બહાર નવા પ્રાઇપ સપ્લાય કોન્ટ્રાક્ટ પ્રાપ્ત કરવાને ગળે આજે જણાવ્યું હતું કે તેની વૈશ્વિક કોર્ડરબુક રૂા.૨૩,૦૦૦ કરોડના નિવેરને પાર કરી ગઇ છે.

કંપનીએ એક્સપેન્જને એક નિયમનકારી યાદીમા જણાવ્યું હતું કે તેને અમેરિકામા પુરવઠા માટે મોટા વ્યાસની કોટેડ લાઇન પાઇપના પુરવઠા માટે નવો નિકાસ ઓર્ડર મળ્યો છે. આ નવા ઓર્ડર સાથે અમારી કુલ વૈશ્વિક ઓર્ડર બુક હવે રૂા.૨૩,૪૬૦ કરોડ (૨.૬ અબજ ડોલર) છે, જે ભારત અને યુએસએ બંને અસ્ક્યામતોમા સ્પષ્ટ બિઝનેસ દ્રશ્યતા અને સાતત્ય આપે છે, તેમ તેમણે ઉમેરતા જણાવ્યું હતું. ઉપરોક્ત ઓર્ડર બુક નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬, નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ અને નાણાકીય વર્ષ ૨૦૨૭-૨૮ દરમિયાન અમલમા મુકવામા આવશે. વેલસ્પન વર્લ્ડની મુખ્ય કંપની વેલસ્પન કોર્પ લિમિટેડ (અલ્યુમિનિયમ) વૈશ્વિક સતરે મોટા વ્યાસની પાઇપના સૌથી મોટા ઉત્પાદકોમાથી એક છે.

એન્જીનિયરીંગ લીમીટેડ

L29306GJ2017PLC099085

રજીડક સબ-સ્ટેશન પાછળ, ઓટવ રોડ, અમદાવાદ-૩૮૨ ૪૧૫

estorconnect@anupengg.com વેબસાઇટ: www.anupengg.com

સ્ટલ બેલોટ નોટીસ

વાઇઠો સાથે વંચતા કંપની (‘અવસ્થાપન અને પ્રશાસન’) નિયમો, ૨૦૧૪ (નિયમો) ના નિયમ ૨૦ અને ૨૨, સિક્કોનીટીટી અને એક્સચેન્જ (‘એસી એલઓપીઅર રેગ્યુલેશન્સ’) અને કોર્પોરેટ અર્કેસ મંચાલ દ્વારા જારી કરવામાં આવેલા જનલ સરક્યુલર નં. ૧૪/૨૦૨૦ તારીખ જાન્યુઆરી પરીપત્રો, નવો ૦૭/૨૦૨૫ પ તારીખ ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૫ (‘એમસીએ સરક્યુલર્સ’) અન્વયે કંપનીએ તારીખ ૧૦ નવેમ્બર, ૨૦૨૫ કરવામાં આવે છે કે પોસ્ટલ બેલોટ નોટીસ તેમજ સંબંધિત ખુલાસા નિવેદનો અને રીમોટ ઇ-વોટીંગ દ્વારા મત આપવાની સુચનાઓ એવા સભ્યોને ટીમીશીપનન્ના રેકોર્ડમાં હતી.

ઓફ ડેટ) ના રોજ રજીસ્ટર ઓફ મેમ્બર્સ/નેશનલ સિક્કોનીટીટી ડિપોઝીટરી લીમીટેડ (‘એનએસડીએલ’) અને સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસીટી તેમને ઉમેઇલ દ્વારા પોસ્ટલ બેલોટ નોટીસ મોકલવામાં આવી છે. કટ-ઓફ ડેટના રોજ સભ્યોના નામે રજીસ્ટર્ડ શેરોની ભરપાઇ થયેલ મુદ્દી પરે.

મોકલેલ નથી અને સભ્યો ફક્ત રીમોટ ઇ-વોટીંગ સવલતનો ઉપયોગ કરીને તેમના મત આપી શકે છે.

પીપોઝીટરી પાર્ટીશીપનન્ની યાદીમાં ન હતા તેવા સભ્યો કંપનીના આરટીએ એટલે કે એમપુએક્જી છનટાઇમ ઇનિયા પ્રાઇવેટ લીમીટેડને anupengg.com પર ઉમેઇલ કરીને પોસ્ટલ બેલોટમા જણાવેલ ખાસ કામઝો પર તેમના મત આપવા માટે પોતાના ઉમેઇલ રજીસ્ટર્ડ કરાવી ને નંબર/પીપી આઇપી/કલાઇન આઇડી અને શેરોની સંખ્યા ઉમેઇલ દ્વારા ‘અનુપ - પોસ્ટલ બેલોટ - ઉમેઇલ એક્સ રજીસ્ટ્રેશન’ ના શીર્ષક હેઠળ સંસોનીટીટી પાર્ટીશીપનન્ પાસે નોંધાયેલ નથી, તેવા સભ્યો પોસ્ટલ બેલોટ નોટીસની સુચના નહીં હ વાંચવા વિનંતી છે.

સંસોનીટીટીઆના નિયમન ૪૪ મુજબ, કંપની તેના સભ્યોને એનએસડીએલ દ્વારા પુરી પડયેલ રીમોટ ઇ-વોટીંગ દ્વારા પોસ્ટલ બેલોટ નોટીસમાં

<p>યુઆરી ૨૦૨૬</p> <p>યુઆરી, ૨૦૨૬</p> <p>યુઆરી, ૨૦૨૬ (સવારે ૯:૦૦ વાગ્યે)</p> <p>યુઆરી, ૨૦૨૬ (સાંંં પ:૦૦ વાગ્યે)</p> <p>યુઆરી, ૨૦૨૬ (સાંં પ:૦૦ વાગ્યે)</p> <p>પટેલ, મેરેસ એગેલઓપી એન્ડ કો.એગેલઓપી, વ્યવસાયિક કંપની સેક્ટેરી (સીપી નં. ૧૬૪૯૭) ના નિયુક્ત ભાગીદાર, રાજે, મેનેજર, ઇમેઇલ: - evoting@nsdl.com અથવા ૦૨૨-૪૮૮૬ ૭૦૦૦ ને કોલ કરવો.</p>
--

રીમોટ ઇ-વોટીંગ સુવિધા દ્વારા જ મત આપી શકે છે કારણકે કંપનીએ કોઇ પોસ્ટલ બેલોટ લોર્મ મોકલ્યા નથી. (૨) સભ્યો જેમને તેમના રીમોટ ઇ-વોટીંગની સુચનાઓ મળી નથી તેઓ અમારા આરટીએ એટલે કે એમપુએક્જી છનટાઇમ ઇનિયા પ્રાઇવેટ લીમીટેડને anupengg.com પર ઉમેઇલ મોકલીને મેલવી શકે છે. (૩) પોસ્ટલ બેલોટ નોટીસની નડલ અને સભ્યોના ઉમેઇલ એક્સ રજીસ્ટ્રેશનની કડિયા દ્વારા તેમજ ખુલાસા નિવેદનો બીએસઇ લીમીટેડ (www.bseindia.com) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇનિયા લીમીટેડ કંપનીના ઇક્વિટી શેરો લીસ્ટેડ છે). (૪) શ્રીમતી અંકિતા પટેલ, મેરેસ એગેલઓપી એન્ડ કો. એલએલપીના નિયુક્ત ભાગીદાર, વ્યવસાયિક ઇ-વોટીંગ/પોસ્ટલ બેલેટનું સંચાલન કરવા માટે સ્ટુડીનાઇઝર તરીકે નિમણૂક કરવામા આવી છે. (૫) ઉલ્કેકેસીટી માધ્યમોથી વોટીંગને સંબંધિત ટ લીમીટેડનો ahmedabad@in.mpmf.com, સ્ટુડીનાઇઝરનો alapanadcollip@gmail.com અને કંપનીનો ઇમાર વોટીંગના પરિણામો સોમવાર, ૯ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ અથવા તે પહેલા જારી કરવામાં આવશે. જારી કરેલ પરિણામો અને રીમોટ ઇ-વોટીંગની વેબસાઇટ www.evoting.nsdl.com પર પણ ઉપલબ્ધ રહેશે. આ સિવાય સ્ટોક એક્સચેન્જ કે જેમાં કંપનીના શેરો લીસ્ટેડ

ધ અનુપ એન્જિનિયરીંગ લીમીટેડ વતી

સહી/-

લથ દેસાઈ

કંપની સેક્રેટરી